

અમદાવદ મ્યુનિસિપલ કોર્પોરેશન  
મહાનગર સેવા સંદર્ભ  
સરદાર પટેલ ભવન  
આસ્ટોડીયા રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧



માહિતી(મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫  
પ્રો-એક્ટીવ ડિસ્કલોગર  
(સને ૨૦૧૬)

ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ  
ફોન નં. ૨૫૩૯૮૯૯  
એક્ષ. ૫૪૬, ૪૧૮, ૬૮૪, ૫૮૮

## અનુક્રમણિકા


અનુક્રમ	વિષય
૧	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું વહીવટી માળખું અને કામગીરી
૨	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓની ફરજો તથા સત્તાઓ
૩	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફની ડિરેક્ટરી
૪	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓના માસિક મહેનતાશા/ ભથ્યાંની વિગત
૫	સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવાના નિયમો બાબત
૬	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતામાં નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પદ્ધતિ
૭	પેન્ડિંગ ખાતાકીય તપાસના વિગતો
૮	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું મંજુર થયેલ બજેટ
૯	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના એપેલેટ, ઓથોરીટી, તથા જાહેર માહિતી અધિકારીની વિગત

## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું વહીવટી માળખું અને કામગીરી

### (૧) વહીવટી માળખું

- (એ) કચેરીનું સ્થળ :- અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ  
સરદાર પટેલ ભવન, પ્રથમ માળે, "સી" બ્લોક  
સેન્ટ્રલ ઓફિસની બાજુમાં, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
- (બી) કચેરીનો સમય :- સવારના ૧૦:૩૦ થી ૬:૧૦ સુધી  
(૨:૦૦ થી ૨:૩૦ રીસેસ)
- (સી) ખાતાના વિભાગો:- મુખ્ય ચાર વિભાગમાં કામ કરે છે.  
(૧) ખાતાનું એસ્ટાબ્લીશમેન્ટ  
(૨) લેબર સેલ(લેબર કોર્ટની કામગીરી)  
(૩) સફાઈ કામદારોના આશ્રિતોને નોકરી  
(૪) ખાતાકીય તપાસ

### વહીવટી માળખું



ખાતાકીય તપાસ અધિકારી	એસ્ટાબ્લીશમેન્ટ કલાર્ક	રેનો ગ્રાફર	વેલફાર કમ લેબર ઓફિસર	કો. ઓફિનિશન ઓફિસર
૧ શ્રી એસ.કે. ટાકર	(સીની.કલાર્ક)	ટાઇપીસ્ટ કમ કલાર્ક	ઉભયુઅલઓ (આશ્રિતને નોકરી)	સીની.કલાર્ક
૨ શ્રી એસ.એન. શુક્લ		જુ.કો.ઓપરેટર	ઉભયુઅલઓ(લેબર કોર્ટ/ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ)	જુ.કલાર્ક
૩: શ્રી એલ.એ.શાહ			ઉભયુઅલઓ(મજૂર કમિ.નીકચેરી અને આશ્રિતને નોકરી)	પટાવાળા
૪: શ્રી રમણલાલ .વી.બારીયા			ઉભયુઅલઓ(વર્ગ ૩-૪ની ખાતાકીય કાર્યવાહી કરવી)	
૫: શ્રી યશવંત એસ.બારોટ				
પ્રેઝન્ટીંગ ઓફિસર				
શ્રી મનુભાઈ આર.તલાવીયા				
પ્રેઝન્ટીંગ ઓફિસર કમ સંકલન અધિકારી				
શ્રી. એન.એચ.લાલવાણી				

## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની મુખ્ય કામગીરી

- (૧) ભૂનિ.કોપોરેશનના તમામ ખાતાઓને મજૂર પ્રશ્નોમાં માર્ગદર્શન, સલાહ તથા અભિપ્રાયો આપવા.
- (૨) ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ, લેબર કોર્ટ તથા લેબર કાયદાઓ નીચે રચાયેલ જુદી જુદી ઓથોરીટીઓ સમક્ષ દાખલ થયેલા કેસોનું સંકલન, ભૂનિ.કોપોરેશન તરફથી બચાવ કરવો, એડવોકેટોને માહિતી આપી જવાબો ફાઈલ કરાવવા.
- (૩) ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ તથા લેબર કોર્ટના એવોર્ડનો અમલ કરાવવો અથવા અપીલ કરવાની કામગીરી.
- (૪) મજૂર કમિશનરશ્રીની કચેરીમાં ચાલતી કન્સીલીએશન કાર્યવાહીમાં રજુઆત કરવી, કન્ટ્રોલીંગ ઓથોરીટી તથા એપેલેટ ઓથોરીટી સમક્ષના ગ્રેજ્યુટીના કેસોની કામગીરી.
- (૫) યુનીયનોના પત્રો તથા રજુઆતો સ્વીકારવી અને સક્ષમ સત્તા પાસે નિર્ણય કરાવવો તથા યુનીયનોના હોદ્દેદારો તથા ઓથોરીટીઓ સાથે મીટિંગનું આયોજન.
- (૬) હેલ્થ કોન્ઝરવન્સી, રેફ્યુઝ તથા ખાળકુવા ખાતાના કામદારોના ભરણ તથા નોકરી દરમ્યાન (મેડીકલ તપાસમાં) અનફીટ થવાના પ્રસંગે તેમના વારસદારોને રહેમરાહે નોકરી આપવાની કામગીરી.
- (૭) ભૂનિ.કર્મચારીઓ તથા અધિકારીઓ વિરુધ્ધની ખાતાકીય તપાસની કામગીરી:- ચાર્જશીટ, શો કોઝ નોટિસ, શિક્ષાના હુકમોના ડ્રાફ્ટિંગ, શિક્ષાના હુકમો ઈસ્યુ કરવા તથા અમલ કરાવવાની કામગીરી.
- (૮) બી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૮ ની કલમ: પદ(૪) નીચે કર્મચારીઓએ સ્ટે.કમિટીને કરેલ અપીલની કાર્યવાહી તથા અપીલમાં સ્ટે.કમિટીએ કરેલ ઠરાવના અમલ.
- (૯) સર્વિસ મેટરમાં આવેલ હાઇકોર્ટ, સીટી સીવીલ કોર્ટ, તથા અન્ય કોર્ટના ચુકાદાઓના અમલીકરણ તથા અપીલની કામગીરી.
- (૧૦) કર્મચારીઓના પ્રશ્નો અંગે મીટિંગનું આયોજન.

સને ૨૦૧૬

## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીની ફરજો તથા સત્તાઓ

અ.નં.	અધિકારી/ કર્મચારીનું નામ	હોદ્દો	સત્તાઓ			ફરજો/ કામગીરીની ટૂંકી વિગત
			વહીવટી	નાણાંકીય	અન્ય	
૧	ડૉ. નરેન છ. હજારી	લેબર ઓફિસર	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની તમામ વહીવટી સત્તાઓ	રૂ. ૧૦૦૦/-	-	<ul style="list-style-type: none"> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની વહીવટી દેખરેખ, નિયંત્રણ તથા સુપરવીઝન</li> <li>- તમામ ખાતાઓને મજૂર પ્રશ્નોમાં સલાહ તથા માર્ગદર્શન આપવું.</li> <li>- ગુજરાત હાઇકોર્ટની સર્વીસ મેટરોની કામગીરી.</li> <li>- લેબર તથા ઈન્ડસ્ટ્રીયલ રીલેશન કામગીરી ઉપર દેખરેખ તથા સંકલન, સુપરવીઝન</li> <li>- સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવાની કાર્યવાહી</li> <li>- મજૂર પ્રશ્નોમાં વહીવટી અને નીતિ-વિષયક નિર્ણય લેવડાવવા.</li> </ul>
૨	શ્રી હિમાંશુ છ. ત્રિવેદી	આસી.મેનેજર	હાથ નીચેના સ્ટાફનું સુપરવિઝન અને દેખરેખ	-	-	<ol style="list-style-type: none"> <li>૧) તમામ ખાતાના કર્મચારીઓના સસ્પેન્શનના હુકમની કાર્યવાહી</li> <li>૨) તમામ ખાતાના વર્ગ-૧ તથા વર્ગ-૨ ના કર્મચારીઓની શોકોઝ નોટીસ, ચાર્જશીટ, ફાઈનલ શોકોઝ નોટીસ તથા હુકમો સંબંધીત કાર્યવાહી</li> <li>૩) હાઇકોર્ટ એડવોકેટ સાથે સંકલનની કામગીરી</li> <li>૪) રાજ્ય સરકાર સાથે થતા પત્ર વ્યવહાર અંગેની કાર્યવાહીની કામગીરી</li> <li>૫) તમામ ડે.ભૂનિ.કમિશરશ્રીઓ સાથે કર્મચારીઓની સુનાવણી અંગેની કામગીરી</li> </ol>
૩	શ્રી તુલસીદાસ એસ.રાઠવા	સંકલન અધિકારી	ખાતાકીય તપાસ કચેરીના સ્ટાફનું સુપરવિઝન અને કામગીરી ઉપર દેખરેખ	-	-	<ol style="list-style-type: none"> <li>૧) તમામ ખાતાના કર્મચારીઓની શોકોઝ નોટીસ, ચાર્જશીટ, ફાઈનલ શોકોઝ નોટીસ તથા હુકમો સંબંધીત કાર્યવાહી (બજવણી, કર્મચારીઓએ આપેલ જવાબ બાદની કાર્યવાહી)</li> <li>૨) તમામ ડે.ભૂનિ.કમિશરશ્રીઓ સાથે કર્મચારીઓની સુનાવણી અંગેની કામગીરી તથા તેને આનુષંગિક કાર્યવાહી</li> </ol>

૪	શ્રી ગુલામનબી જી. શેખ	વેલફેર કમ લેબર ઓફીસર		-	-	<p>૧) તમામ ખાતાના કર્મચારીઓના સસ્પેન્શનના હુકમની કાર્યવાહી</p> <p>૨) તમામ ખાતાના ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલમાં ચાલતા કેસોની કામગીરી</p> <p>૩) બી.પી.એમ.સી.એક્ટની કલમ-૫૮(૪) નીચે થતી અપીલને લગતી કાર્યવાહી</p> <p>૪) તમામ ખાતાના લેબર કોર્ટના કેસોની કામગીરી</p> <p>૫) ભ્યુનિ.કર્મચારી સામે દાખલ થતા તથા દાખલ કરવામાં આવતાં પોલિસ કેસ તથા એ.સી.બી.કેસોની કામગીરી</p> <p>૬) સીટી સીવીલ કોર્ટ તથા હાઈકોર્ટમાં આઈ.આર.ખાતાને લગતાં કેસોની કામગીરી</p> <p>૭) આર.ટી.આઈ.ને લગતી ખાતામાં આવતી તમામ અરજીઓ તથા તે.ભ્યુનિ.કમિ. (આર.ટી.આઈ.) શ્રી નાં ઓફીસ ઓર્ડર નં.૨ તા.૧૬/૧૨/૧૩ મુજબની કાર્યવાહી કરવી.</p>
૫	શ્રી અમરીષ ડી. જાની	વેલફેર કમ લેબર ઓફીસર		-	-	<p>૧) લેબર કમિશનરની કચેરીમાં ચાલતા કન્સીલીએશનના કેસોની કામગીરી</p> <p>૨) કંટ્રોલિંગ ઓથોરીટી, એપેલેટ ઓથોરીટી તથા મજૂર કાયદાઓ નીચે નિમાયેલ અચ્ય ઓથોરીટીઓના કેસોની કામગીરી</p> <p>૩) પશ્ચિમઝોન, નવા પશ્ચિમઝોન અને મધ્યઝોન હેલ્થ કોન્ઝરવન્સી ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી</p>
૬	શ્રી સતીષચંદ્ર સી. પટેલ	વેલફેર કમ લેબર ઓફીસર		-	-	<p>૧) યુનીયનના પ્રશ્નો તથા સક્ષમ સત્તાઓ સમક્ષ યોજવામાં આવતી મીટિંગોની કામગીરી તથા યુનીયનના આવેદનપત્રો અંગે રીમાર્ક્સ મંગાવી જવાબ પાઠવવાની કામગીરી</p> <p>૫) પૂર્વઝોન, ઉત્તરઝોન તથા દક્ષિણઝોનના હેલ્થ કોન્ઝરવન્સી ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી</p>

૭	શ્રી લક્ષ્મણભાઈ વી. ખાટા	વેફ્ફર કમ લેબર ઓફિસર		-	-	૧) રીમુવલને લગતી કામગીરી ૨) તમામ ખાતાના વર્ગ-૩ તથા વર્ગ-૪ ના કર્મચારીઓની શોકોઝ નોટીસ, ચાર્જશીટ, ફાઈનલ શોકોઝ નોટીસ તથા હુકમો સંબંધીત કાર્યવાહી
૮	શ્રી ભરતસિંહ યુ.પરમાર	સ્ટેનોગ્રાફર (ફાળવણીથી)				- ખાતાકીય તપાસમાં આપવામાં આવતા ચાર્જશીટ, સસ્પેન્શન, ફાઈનલ શો કોઝ નોટીસો, શિક્ષાના હુકમો કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરવા. - ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઈપ કરવા. - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું અન્ય કાગળોનું ટાઈપીંગ
૯	શ્રી વર્ષાબીન આર. ઓજા	ટાઈપીસ્ટ- કમકલાર્ક		-	-	- ખાતાકીય તપાસમાં આપવામાં આવતા ચાર્જશીટ, સસ્પેન્શન, ફાઈનલ શો કોઝ નોટીસો, શિક્ષાના હુકમો કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરવા. - ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઈપ કરવા. - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું અન્ય કાગળોનું ટાઈપીંગ
૧૦	શ્રી મહેશકુમાર બી.પારેખ	જુ.કો.ઓપરેટર		-	-	- ખાતાકીય તપાસના ચાર્જશીટ, શો કોઝ નોટીસ, સસ્પેન્શન હુકમ, શિક્ષાના હુકમોના ડ્રાફ્ટ કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરવા. - ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઈપ કરવા. - ખાતાની અન્ય ટાઈપીંગ કામગીરી
૧૧	શ્રી બ્રિજેશકુમાર જે. નાયક	સ્ટેનોગ્રાફર		-	-	- હાલમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ખાતે ફાળવણીથી ફરજ બજાવે છે.
૧૨	શ્રી ભાનુપ્રસાદ જે. પટેલ	સીની.કલાર્ક		-	-	- ચાર્જશીટના ડ્રાફ્ટ ટાઈપ કરાવવા, કમ્પેર કરવા અને સક્ષમ સત્તા સમક્ષ એમુવલ માટે મુકવા - એમુવ થયેલ ચાર્જશીટના ડ્રાફ્ટ જેતે કર્મચારીને બજાવવા મોકલવા તથા ફાઈલ ઈન્કવાયરી ઓફિસરને મોકલવી
૧૩	શ્રી મયુરીબેન સી.પટેલ	સીની.કલાર્ક		-	-	- ઈન્કવાયરી ઓફિસરના રીપોર્ટ ઉપર સક્ષમ સત્તાએ શિક્ષા અંગે જે નિર્ણય લીધેલ હોય તેના અનુસંધાનમાં તૈયાર કરેલ શો કોઝ નોટીસના ડ્રાફ્ટ ટાઈપ કરાવી સક્ષમ સત્તા સમક્ષ મુકવા - એમુવ થયેલ શો કોઝ નોટીસ જેતે કસુરદાર કર્મચારીને ઈસ્યુ કરવી.

૧૪	હાલ જગ્યા ખાલી (શ્રી ભાનુપ્રસાદ જે. પટેલ હાલમાં કામગીરી સંભાળે છે.)	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના એસ્ટાબ્લીસમેન્ટની કામગીરી</li> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફના પગાર તથા સર્વીસ બુકની જગ્યાણી</li> <li>- લેબર કોર્ટ, ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ કેસોના રજીસ્ટરોની જગ્યાણી તથા મેઈન્ટેનન્સલ, વાર્ષિક વહિવટી અહેવાલ તૈયાર કરવો.</li> <li>- ખાતાના અન્ય પરચુરણ બીલોની કામગીરી</li> </ul>
૧૫	શ્રી મૌનાબેન એ. પંડીત	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- સેન્ટ્રલ ઓફિસ તથા વિઝલન્સ ખાતા દ્વારા હાથ ધરવામાં આવતા સરપ્રાઇઝ ચેકીંગમાં ગેરહાજર માલુમ પડતા કર્મચારીઓને શો કોઝ નોટિસો તૈયાર કરવી, એપ્રુવ કરાવવી તથા ઈસ્યુ કરવી.</li> <li>- ઉપરોક્ત શો કોઝ નોટિસના ખુલાસાઓ મેળવવા અને સક્ષમ સત્તા સમક્ષ મુક્તિ નિર્ણય કરાવવો.</li> <li>- શિક્ષાના હુકમો તૈયાર કરવા અને ઈસ્યુ કરવા</li> <li>- પ્રમોશન તથા કાયમ કરવા સમયે કર્મચારીઓને ખાતાકીય તપાસનું એન.ઓ.રી. આપવું.</li> </ul>
૧૬	શ્રી ભીખાભાઈ એમ. પટેલ	સીની..કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ખાતાકીય તપાસ કચેરીની ટપાલ લેવી, ઈન્વર્ડ કરવી તથા જેતે અધિકારી સમક્ષ મુકવાની કામગીરી</li> <li>- દફ્તરે થતી ઈન્કવાયરી ફાઈલોની વર્ગીકરણ અને જગ્યાણી</li> <li>- આઈ.આર.ઈએસ્ટી. ના હુકમો ઈસ્યુ કરવાની કામગીરી</li> </ul>
૧૭	શ્રી કમલેશ એચ. પુરોહિત	સીની.કલાર્ક		-	-	- રાઈટ દ્વારા ઈન્ફોર્મેશન નીચેની અરજીની કામગીરી.
૧૮	શ્રી જૈની બી. શાહ	જુનિ. કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ઈન્કવાયરી સેલ સિવાયની તમામ ટપાલ લેવી, ઈન્વર્ડ કરી લેબર ઓફિસરને મુકવી તથા ટપાલ આઉટવર્ડ કરી જેતે ખાતાઓને મોકલવી.કન્ટીજન્સીને લગતી કામગીરી કરવી.</li> <li>- બી.પી.એમ.સી. એકટની કલમ: પદ(૪) નીચે થતી અપીલની કામગીરી.</li> <li>- ઈન્કવાયરી ઓફિસરના પત્રો તથા ખાતાના અન્ય પત્રોના પોસ્ટ-રજી.પોસ્ટ એડી.ની કામગીરી</li> </ul>
૧૯	શ્રી રમણભાઈ પી. શર્મા	પટાવાળા		-	-	- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની તમામ બહારના ખાતાઓના ટપાલની કામગીરી
૨૦	શ્રી ગોવિંદભાઈ પી. નાથી	પટાવાળા		-	-	- ખાતાકીય તપાસ કચેરીના પટાવાળાની કામગીરી અને ખાતાકીય તપાસને લગતી ફાઈલોની કામગીરી.

૨૧	શ્રી પોપટભાઈ જી. વાધેલા	પટાવાળા		-	-	- ઈન્કવાયરી ઓફિસરો પાસે પટાવાળાની કામગીરી
૨૨	શ્રી જસપાલ રતનલાલ રોટ	પટાવાળા		-	-	- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની અંદરના ખાતાઓની ટપાલની કામગીરી
૨૩	શ્રી પોપટભાઈ બી. રાવળ	પટાવાળા		-	-	- લેબર ઓફિસરની મુખ્ય ઓફિસે પટાવાળાની કામગીરી

★ શ્રી ભરતસિંહ યુ.પરમાર , શ્રી મહેશકુમાર બી.પારેખ, શ્રી વધાબેન આર. ઓજા , શ્રી મયુરીબેન સી.પટેલ તથા શ્રી જેની બી. શાહનો પગાર આઈ.આર. ખાતેથી નીકળતો નથી.

## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફની ડિરેક્ટરી

અ. ન.	એમ્પલોઈ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈ-મેઇલ
				ક્યોરી	મોબાઈલ	ધર		
૧	૮૩૭૫	ડૉ. નરેન જી. હજારી	લેબર ઓફિસર	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૫૪૬)	૯૩૨૭૦૩૮૭૭૩	૦૭૯- ૨૫૩૮૪૭૪૪		narenhajari@ahmedabadcity. gov.in
૨	૭૮૨૪	શ્રી હિમાંશુ જી. ત્રિવેદી	આસી. મેનેજર	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૫૮૮)	૯૩૨૭૫૫૪૮૯૨	--	--	htrivedi@ahmedabadcity. gov.in
૩	૧૦૫૬	શ્રી તુલસીદાસ એસ. રાઠવા	સંકલન અધિકારી	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)	--	--	--	
૪	૬૭૬૩	શ્રી ગુલાબનબી જી. શેખ	ડબલ્યુ.એ લારો.	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૩૨૮૩૮૫૫૬૪	--	--	
૫	૮૩૮૧	શ્રી અમરિષ ડી. જાની	ડબલ્યુ.એ લારો	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૩૨૮૩૮૫૫૬૫	--	--	
૬	૬૨૩૮	શ્રી સતીષ સી. પટેલ	ડબલ્યુ.એ લારો	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૩૨૮૩૮૫૫૬૬			
૭	૮૫૨૭	શ્રીલક્ષ્મણભાઈ વી. ખાટા	ડબલ્યુ.એ લારો	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૩૨૭૦૩૮૮૪૩			
૮	૭૨૦૭૪	શ્રી ભરતસિંહ યુ. પરમાર	સ્ટેનોગ્રાફર	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૪૧૮)	૯૭૧૨૬૭૦૬૮૦			
૯	૪૮૫૬	શ્રી વધ્યબીન આર. ઓળા	ટાઈપીસ્ટ ક્રમ કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૦	૭૨૧૫૩	શ્રી મહેશકુમાર બી. પારેખ	જી.કો. ઓપરેટર	૨૫૩૮૯૮૯૯ (એક્ષ. ૬૮૪)				
૧૧	૭૨૦૮૭	શ્રી બ્રિજેશકુમાર જી. નાયક	સ્ટેનોગ્રાફર	૨૩૨૫૧૦૧૪ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર				

૧૨	૭૫૨૫	શ્રી ભાનુપ્રસાદ જે.પટેલ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૩	૭૬૭૨	શ્રી મૌનાબેન એ. પંડીત	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૪	૬૮૪૮	શ્રી મયુરી સી. પટેલ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૫	૭૬૨૭	શ્રી ભીખાભાઈ એમ.પટેલ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૬	૮૬૮૭	શ્રી કમલેશભાઈ એચ. પુરોહિત	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૭	૮૩૮૨	શ્રી જેનીબેન બી. શાહ	જુની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૮	૩૪૦૮૨	શ્રી રમણભાઈ પી. શર્મા	પટાવાળા					
૧૯	૩૪૧૨૩	શ્રી ગોવિંદભાઈ પી. નાથી	પટાવાળા					
૨૦	૮૧૦૭૪	શ્રી પોપટલાલ જ. વાધેલા	પટાવાળા					
૨૧	૩૮૧૮૪	શ્રી જસપાલ આર.રોત	પટાવાળા					
૨૨	૩૮૩૩૦	શ્રી પોપટભાઈ બી. રાવળ	પટાવાળા					

## ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓના માસિક મહેનતાણાનું સ્ટેટમેન્ટ

અ.નં.	એમ્બ્લોઝ નં.	નામ	છોટો	માસિક મહેનતાણાં / પગાર	વળતર ભથ્યું	નીતિનિયમ મુજબ મહેનતાણાં નક્કી કરવાની પદ્ધતિ
૧.	૮૩૭૫	ડૉ. નરેન જી. હજારી	લેબર ઓફિસર	૧૫૬૦૦-૩૮૧૦૦ (ગ્રેડ-પે દ્વારા ૬૬૦૦)	કોર્પોરેશન દ્વારા વાહન ફાળવવામાં આવેલ છે.	નામ. આબ્દીટ્રિટરના એવોઈ અન્યે તથા રાજ્ય સરકારના પગાર પંચ અન્યે પગાર ધોરણ રીવાઈઝ કરવામાં આવે છે.
૨.	૭૮૨૪	શ્રી હિમંતુ જી. ત્રિવેદી	આસી. મેનેજર	૧૫૬૦૦-૩૮૧૦૦ (ગ્રેડ-પે દ્વારા ૬૬૦૦)	--	“““““
૩.	૧૦૫૬	શ્રી તુલસીધાસ એસ. રાઠવા	કો.ઓ. ઓફિસર	૮૩૦૦-૩૪૮૦૦ (૪૮૦૦)	“	“““““
૪.	૬૭૬૩	શ્રી ગુલામનભી જી. શેખ	ડબલ્યુ. એલ. ઓ.	૮૩૦૦-૩૪૮૦૦ (૪૮૦૦)	“	“““““
૫.	૬૨૩૮	શ્રી સતીષ સી. પટેલ	ડબલ્યુ. એલ. ઓ.	૮૩૦૦-૩૪૮૦૦ (૪૮૦૦)	“	“““““
૬.	૮૩૮૧	શ્રી અમરીષ ડી. જાની	ડબલ્યુ. એલ. ઓ.	૮૩૦૦-૩૪૮૦૦ (૪૮૦૦)	“	“““““
૭.	૮૪૨૭	શ્રી લક્ષ્મણભાઈ વી. ખાતા	ડબલ્યુ. એલ. ઓ.	૮૩૦૦-૩૪૮૦૦ (૪૬૦૦)	“	“““““
૮.	૭૨૦૭૪	શ્રી ભરતસિંહ યુ. પરમાર	સ્ટેનોગ્રાફર	૮૩૦૦-૩૪૮૦૦ (૪૬૦૦)	“	“““““
૯.	૪૮૫૬	શ્રીમતી વર્ષાબેન આર. ઓઝા	ટાઈપીસ્ટ કમ. કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦ (૪૬૦૦)	કન્વેઅન્સ એલાઉન્સ મળતું નથી.	“““““
૧૦.	૭૨૧૫૩	શ્રી મહેશકુમાર બી. પારેખ	જુ.કો.ઓપરેટર	૫૨૦૦-૨૦૨૦૦ (૨૪૦૦)	“	“““““
૧૧.	૭૨૦૮૭	શ્રી બિજેશકુમાર જે. નાયક	સ્ટેનો ગ્રાફર	૮૩૦૦-૩૪૮૦૦ (૪૬૦૦)	“	“““““

૧૨.	૭૯૨૫	શ્રી ભાનુપ્રસાદ જે.પટેલ	સીની. કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	“	“““““
૧૩.	૭૬૭૨	શ્રીમતી મૌનાબેન એ. પંડીત	સીની. કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	“	“““““
૧૪.	૬૮૪૮	શ્રીમતી મહુરીબેન સી.પટેલ	સીની.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	“	“““““
૧૫.	૭૯૨૭	શ્રી ભીખાભાઈ એમ. પટેલ	સીની. કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	“	“““““
૧૬.	૮૬૩૬	શ્રી કુમલેશ એચ. પુરોહિત	સીની. કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦ (૪૨૦૦)	“	“““““
૧૭.	૮૩૮૨	શ્રીમતી જૈનીબેન બી. શાહ	જુની. કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ (૨૪૦૦)	“	“““““
૧૮.	૩૮૩૩૦	શ્રી રાવળ પોપટભાઈ બી.	પટાવણા	૪૪૪૦-૭૪૪૦ (૧૩૦૦)	“	“““““
૧૯.	૩૮૧૮૨	શ્રી જસપાલ આર. રોત	પટાવણા	૪૪૪૦-૭૪૪૦ (૧૩૦૦)	“	“““““
૨૦.	૩૪૦૯૨	શ્રી રમણભાઈ પી. શર્મા	પટાવણા	૫૨૦૦-૨૦૨૦૦ (૧૬૦૦)	“	“““““
૨૧.	૩૪૧૨૩	શ્રી ગોવિંદભાઈ પી. નાઈ	પટાવણા	૫૨૦૦-૨૦૨૦૦ (૧૬૦૦)	“	“““““
૨૨.	૮૧૦૭૪	શ્રી પોપટલાલ જી. વાધેલા	પટાવણા	૪૪૪૦-૭૪૪૦ (૧૬૪૦)	“	“““““

- શ્રી ભરતસિંહ યુ.પરમાર ,શ્રી મહેશકુમાર બી.પારેખ, શ્રી મહુરીબેન સી.પટેલ, શ્રી વર્ષાબેન આર. ઓજા તથા શ્રી જૈની બી. શાહનો પગાર આઈ.આર. ખાતેથી નીકળતો નથી.

**સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા માટેના નિયમો**

(૧)	નિયમોનું નામ	સફાઈ કામદારો, રેફયુઝ તથા ખાળકુવા ખાતાના કામદારોને ભરણ તથા નોકરી દરમ્યાન અનફીટ થાય તો તેના વારસદારને રહેમરાહે નિમણૂક આપવી
(૨)	દસ્તાવેજનો પ્રકાર	<ul style="list-style-type: none"> <li>(૧) સ્ટે.કમિટી ઠરાવ નં. ૧૨૮૬, તા. ૧૮.૧.૦૬</li> <li>(૨) ખુ.કો.ઠરાવ નં. ૧૦૮૩, તા. ૧૮.૧.૦૬</li> <li>(૩) રહેમરાહે નોકરી આપવાના નિયમો પરિશિષ્ટ-એ</li> <li>(૪) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ, સરક્યુલર નં. ૧, તા. ૨૮.૬.૦૬</li> <li>(૫) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ સરક્યુલર નં. ૧, તા. ૧૧.૬.૦૮</li> <li>(૬) પપ વર્ષનો સરક્યુલર તા. ૧૮.૫.૨૦૧૦</li> <li>(૭) સ્ટે.કમિટી ઠરાવ નં. ૩૫૬, તા. ૨૦.૬.૧૫, ખુ.કો.ઠરાવ નં. ૪૭૫ તા. ૨૮.૭.૧૫ મુજબ, ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ, સરક્યુલર નં. ૧, તા. ૨૮.૮.૧૫</li> </ul>
(૩)	વારસદારની નોકરીના નિયમોની નકલ કયાંથી મળી શકશે	લેબર ઓફીસર ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ ફોન નં. ૨૫૩૮૧૮૧૧ EPBX- ૫૪૬, ૪૧૮

## નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પદ્ધતિ

ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ત્રાણ વિભાગો (૧) એસ્ટાબ્લીસમેન્ટ (૨) લેબર-વેલ્કેર તથા (૩) ખાતાકીય તપાસ વિભાગમાં નિર્ણય લેવા માટે ફાઈલ નીચેના કમમાં મુકવામાં આવે છે.

(૧) એસ્ટાબ્લીસમેન્ટ -	જુનિ. કલાર્ક	સીની. કલાર્ક	આસી. મેનેજર આઈ.આર.	લેબર ઓફિસર	ડે. મ્યુનિ. કમિશર (આઈ.આર.)
-----------------------	--------------	--------------	--------------------	------------	----------------------------

(૨) લેબર વેલ્કેર ઓફિસર (વારસદારની નિમણૂંક કરવી)	W.L.O.	આસી. મેનેજર આઈ.આર.	લેબર ઓફિસર	ડાયરેક્ટર (એસ.ડિ.બલ્યુ.એમ)
--	--------	--------------------	------------	-------------------------------

(૩) ખાતાકીય તપાસ વિભાગ

ઈન્કવાયરી ઓફિસર	સંકલન અધિકારી આઈ.આર.	લેબર ઓફિસર	<div style="border: 1px solid black; padding: 5px; margin-bottom: 5px;">           ડે. મ્યુનિ. કમિ. (પદ્ધતિ/એસ્ટેટ)         </div> <div style="border: 1px solid black; padding: 5px; margin-bottom: 5px;">           ડે. મ્યુનિ. કમિ. (નાણાં /આઈ.આર.)         </div> <div style="border: 1px solid black; padding: 5px; margin-bottom: 5px;">           ડે. મ્યુનિ. કમિ. (નવા પદ્ધતિ/સેન્ટ્રલ વર્કશૉપ)         </div> <div style="border: 1px solid black; padding: 5px; margin-bottom: 5px;">           ડે. મ્યુનિ. કમિ. (વહિવટ/ટેક્ષ)         </div> <div style="border: 1px solid black; padding: 5px; margin-bottom: 5px;">           ડે. મ્યુનિ. કમિ. (મધ્યઝોન/ હોસ્પિટલ)         </div> <div style="border: 1px solid black; padding: 5px; margin-bottom: 5px;">           ડે. મ્યુનિ. કમિ.. (પૂર્વઝોન/ યુ.સી.ડી.)         </div> <div style="border: 1px solid black; padding: 5px; margin-bottom: 5px;">           ડે. મ્યુનિ. કમિ. (ઉત્તરઝોન/બજીયા)         </div> <div style="border: 1px solid black; padding: 5px; margin-bottom: 5px;">           ડે. મ્યુનિ. કમિ. (દક્ષિણઝોન/હેલ્થ)         </div>		
આસી. મેનેજર આઈ.આર.	લેબર ઓફિસર				મ્યુનિ. કમિશર

**મ્યુનિસિપલ કર્મચારીઓ / અધિકારીઓ સામેની પેન્ડિંગ ખાતાકીય તપાસ**

(૩૦-૪-૧૬ ની સ્થિતિ)

નં.	ઈન્કવાયરી ઓફિસરનું નામ	હેલ્લા વર્ષ દરમ્યાન નિકાલ કરેલ ખાતાકીય તપાસ	હાલ પેન્ડિંગ ખાતાકીય તપાસ	હાલ પેન્ડિંગ ખાતાકીય તપાસ					
				૫ વર્ષથી વપુ	૪ વર્ષથી વપુ	૩ વર્ષ સુધીની	૨ વર્ષ સુધીની	૧ વર્ષ સુધીની	૭ માસ સુધીની
૧	શ્રી એસ.કે. ઠાકર	૪૦	૧૧	--	૦૧	--	૦૩	૦૭	--
૨	શ્રી એસ.એન.શુક્રાલ	૩૧	૦૮	૦૨	--	--	--	૦૨	૦૪
૩	શ્રી એલ.એ.શાહ	૧૮	૦૩	--	--	--	૦૧	--	૦૨
૪	શ્રી યશવંત .એસ.બારોટ	૧૫	૦૭	--	--	--	--	-૦૭-	--
૫	શ્રી રમણલાલ વી.બારીયા	૧૮	૦૫	--	--	--	--	-	૦૫

## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું મંજુર થયેલ બજેટ

(હજારમાં)

વીપાર્ટમેન્ટ / એકાઉન્ટ કોડ	ખાતુ તથા એકાઉન્ટ હેડનું નામ	૨૦૧૩-૧૪	૨૦૧૪-૧૫	૨૦૧૫-૧૬	૨૦૧૬-૧૭
૧૦૭ ૩૦૧૮૮	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ પગાર ખર્ચ	૮૯૮૧	૮૨૦૫	૧૧૫૨૧	૧૧૧૮૪
૩૦૩૦૨	ટેલીફોન બીલ રહેઠાણ	૦૦	૦૪	૦૬	૦૮
૩૦૪૦૧	યુનિફોર્મ	૦૭	૧૪	૧૪	૧૪
૩૪૧૦૧	ટેલીફોન તથા ટ્રાંકકોલ (ઓફિસ)	૮૦	૧૦૦	૧૦૦	૧૦૦
૩૪૧૦૨	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૧૫	૧૫	૧૫	૨૫
૩૪૪૦૧	સ્ટેશનરી	૭૦	૭૦	૧૦૦	૧૦૦
૩૪૪૦૪	પ્રેન્ટિંગ	૧૦	૧૦	૪૦	૪૦
૩૪૪૦૫	ઝરોક્ષ	૩૦	૩૦	૪૦	૪૦
૩૪૪૦૮	પુસ્તકો, અખભારો અને સામયિકો	૦૮	૦૮	૦૮	૦૮
૩૪૮૮૮	અન્ય ખર્ચ	૬૫	૬૫	૬૫	૭૫

## એપેલેટ અધિકારી તથા જાહેર માહિતી અધિકારીની વિગતો

નં.	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈ-મેઇલ	સરનામું
			ઓફિસ	મોબાઈલ	ઘર			
1.	ડૉ નરેન જી. હજારી	એપેલેટ અધિકારી	૨૫૭૮૯૮૯૯ અક્ષ. ૫૪૬	૯૮૨૭૦૩૮૭૭૩	૦૭૯- ૨૫૩૮૪૭૪૪	--	narenhajari @ahmedab adcity. gov.in	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧૬૦ માળ, સરદાર પટેલ ભવન, મધ્યરથ કચેરી, દાણાપીઠ, અમદાવાદ
2.	શ્રી ગુલામનભી જી. શોખ	જાહેર માહિતી અધિકારી	૨૫૭૮૯૮૯૯ અક્ષ. ૪૧૮	૯૮૨૮૩૮૫૫૬૪	--	--	--	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧૬૦ માળ, સરદાર પટેલ ભવન, મધ્યરથ કચેરી, દાણાપીઠ, અમદાવાદ